

આરબીઆઈ / 2006-2007 / 245  
ડિબીઓડી નં. ડીઆઈઆર.બીસી 56 /13.03.00/2006/2007

2 ફેબ્રુઆરી, 2007

બધી શીડધૂલ કમર્શિયલ બેંકો  
(આર.બી.આઈ.સીવાય)

માનનીય સાહેબશ્રી,

બેંક ચાર્જસનાં વ્યાજબીપણાની ખાતરી માટે સ્કીમ બનાવવા વર્ક્ષીગ ગ્રુપનો રીપોર્ટ

જેમ બેંકો જાણો છે તેમ, વર્ષ 2006-2007 ના એન્યુઅલ સ્ટેટમેન્ટમાં જાહેર કર્યો મુજબ, બેંકોનું સર્વીસમાં ફેર પ્રેક્ટીસની ખાતરી કરવા, રીજર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ઓક વર્ક્ષીગ ગ્રુપ બેંક ચાર્જસના વ્યાજબીપણાની ખાતરી કરવા એક સ્કીમ બનાવવા તેમજ તેને ફેર પ્રેક્ટીસીઝ ડોડમાં સામેલ કરવા બનાવેલું. જેનું મોનીટરીંગ બેંકીગકોડા અને સ્ટાન્ડર્ડઝ બોર્ડ ઓફ ઇન્ડિયા (બીસીએસબીઆઈ) દ્વારા થશે.ત્યારથી વર્ક્ષીગ બોર્ડ તેનો રીપોર્ટ રજૂ કર્યો છે અને તેને અમારી વેબસાઇટ ([www.rbi.org.in](http://www.rbi.org.in)) પર મૂકવામાં આવ્યું છે વર્ક્ષીગ ગ્રુપની ભલામણો તપાસાઈ છે અને રીજર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કેટલાક સુધારા સાથે સ્વીકારાઈ છે.

2. બેંકોએ લેવા જરૂરી પગલા એકશન પોઇન્ટ્સ ફોર બેંકસ કોલમ હેઠળ આ સરકયુલરના એનેક્સમાં દર્શાવાયા છે.

આપનો વિશ્વાસુ,

(પી.વિજયા ભાસ્કર)  
ચીફ જનરલ મેનેજર

અનેકાર (જોડાણ)

બેંક ચાર્જસના વ્યાજભીપણાની ખાતરી કરવા એક સ્કીમ બનાવવા વર્કીંગ ગ્રુપની ભલામણો.

સીરીયલ નં.	આરબીઆઈએ સ્વીકારેલ વર્કીંગ ગ્રુપની ભલામણો	બેંક માટે એકશન પોઇન્ટ્સ				
1	<p>બેંકીંગ સેવાઓની ઓળખ, બેંકએ બેઝીક બેંકીંગ સેવાઓની ઓખ માટે બે બહોળા પેરામીટરોને અનુસરવું પડે છે :</p> <p>(અ) ટ્રાન્ઝેક્શન્સનો પ્રકાર</p> <table border="1"> <tr> <td>(એ)</td><td>નીડલ અને લોઅર સેગમેન્ટમાં વ્યક્તિત્વો લાભ લે છે તેવી સાધારણ સેવાઓ પહેલું પેરામીટર હશે. આમાં ડીપોઝિટ / લોન અકાઉન્ટ્સ, રેમીટન્સ સર્વીસીઝ અને કલેક્શન સર્વીસીઝનો સમાવેશ થાય છે.</td></tr> <tr> <td>(બી)</td><td>જ્યારે ઉપરના ટ્રાન્ઝેક્શન્સ વિવિધ ડિલીવરી ચેનલોમાં પ્રાઇસીંગના હેતુ માટે થાય ત્યારે તેમને અલગ ફૂટીંગ પર ગણવામાં આવી શકે.</td></tr> </table> <p>(બી) ટ્રાન્ઝેક્શન્સની વેલ્યુ કસ્ટમર્સ/પબ્લિક સાથે ટ્રાન્ઝેક્શન્સની સીલીંગ સુધીની લો વચ્ચુએ બીજો પેરામીટર હશે.</p> <p>(1) દરેકમાં રૂ. 10,000/- સુધીના રેમીટન્સ (2) દરેકમાં રૂ. 10,000/- થી નીચેના કલેક્શન્સ (5,000 ડોલર્સ સુધી વેલ્યુ થયેલ ફોરેન એક્સ્ચેન્જ ટ્રાન્ઝેક્શન્સ) બે પેરામીટર્સ પર આધારિતવ કીંગ ગ્રુપ બેઝીક બેંકીંગ સર્વીસીઝ તરીકે નીચેનાનાં એન્યુમેન્ટનાની ભલામણ કરે છે.</p> <p>ડીપોઝિટ અકાઉન્ટને લગતી</p> <ol style="list-style-type: none"> <li>1. ચેકબુક સવલત</li> <li>2. પાસબુકનું ઈશ્યુ (કે સ્ટેમેન્ટ) / બેલેન્સ સર્ટીફિકેટનું ઈશ્યુ</li> <li>3. કુલ્પીકેટ પાસબુક કે સ્ટેમેન્ટનું ઈશ્યુ</li> <li>4. એટીએમ કાર્ડ</li> <li>5. ડેબીટ કાર્ડ (ઇલેક્ટ્રોનિક ચેક)</li> <li>6. સ્ટોપ પેમેન્ટ</li> <li>7. બેલેન્સ ઇન્કવાયર</li> <li>8. અકાઉન્ટ કલોઝર</li> <li>9. ચેક રીટર્ન - ઈનવર્ડ (પેમેન્ટ માટે રીસીવ થયેલ ચેક)</li> <li>10. સીંનેચર વરીફિકેશન</li> </ol> <p>લોન એકાઉન્ટસને લાગુ પડતું</p> <p>11. નો ડિપુઝ સર્ટીફિકેટ રેમીટન્સ ફિસીલીટીઝ (અન્ય બેંક હારા સમાવાતું) (રૂપી કે ફોરેન એક્સ્ચેન્જ)</p> <p>12. ડીમાન્ડ ફ્રાફટ - ઈશ્યુ</p>	(એ)	નીડલ અને લોઅર સેગમેન્ટમાં વ્યક્તિત્વો લાભ લે છે તેવી સાધારણ સેવાઓ પહેલું પેરામીટર હશે. આમાં ડીપોઝિટ / લોન અકાઉન્ટ્સ, રેમીટન્સ સર્વીસીઝ અને કલેક્શન સર્વીસીઝનો સમાવેશ થાય છે.	(બી)	જ્યારે ઉપરના ટ્રાન્ઝેક્શન્સ વિવિધ ડિલીવરી ચેનલોમાં પ્રાઇસીંગના હેતુ માટે થાય ત્યારે તેમને અલગ ફૂટીંગ પર ગણવામાં આવી શકે.	<p>બેંકને વર્કીંગ ગ્રુપ હારા દશાવેલ બહોળા પેરામીટર્સના આધાર પર બેઝીક બેંકીંગ સર્વીસીઝની ઓળખની સલાહ અપાય છે.</p> <p>વર્કીંગ ગ્રુપ હારા ઓળખેલ સેવાઓનું લીસ્ટ માત્ર દર્શક છે અને બેંક તેમની વિવિક બુધ્યથી, બેઝીક સર્વીસીઝની કેટેગરીમાં તેઓ ધોંય ગણે તેવી એડીશનલ સેવાઓ સમાવી શકે.</p>
(એ)	નીડલ અને લોઅર સેગમેન્ટમાં વ્યક્તિત્વો લાભ લે છે તેવી સાધારણ સેવાઓ પહેલું પેરામીટર હશે. આમાં ડીપોઝિટ / લોન અકાઉન્ટ્સ, રેમીટન્સ સર્વીસીઝ અને કલેક્શન સર્વીસીઝનો સમાવેશ થાય છે.					
(બી)	જ્યારે ઉપરના ટ્રાન્ઝેક્શન્સ વિવિધ ડિલીવરી ચેનલોમાં પ્રાઇસીંગના હેતુ માટે થાય ત્યારે તેમને અલગ ફૂટીંગ પર ગણવામાં આવી શકે.					

	<p>13. ડીમાન્ડ રાફટ દ કેન્સલેશન</p> <p>14. ડીમાન્ડ રાફટ દ રીવેલીડેશન</p> <p>15. ડીમાન્ડ રાફટ - દુપ્લીકેટ ઈશ્યુઅન્સ</p> <p>16. પેમેન્ટ ઓર્ડર - ઈશ્યુ</p> <p>17. પેમેન્ટ ઓર્ડર દ કેન્સલેશન</p> <p>18. પેમેન્ટ ઓર્ડર દ રીવેલીડેશન</p> <p>19. પેમેન્ટ ઓર્ડર - દુપ્લીકેટ ઈશ્યુઅન્સ</p> <p>20. ટેલીગ્રાફીક ટ્રાન્સફર - ઈશ્યુ</p> <p>21. ટેલીગ્રાફીક ટ્રાન્સફર દ કેન્સલેશન</p> <p>22. ટેલીગ્રાફીક ટ્રાન્સફર - દુપ્લીકેટ ઈશ્યુઅન્સ</p> <p>23. પેમેન્ટ બાયર્ટલેક્ટ્રોનીક કલીયરીંગ સર્વીસીઝ (ઇસીએર)</p> <p>24. ટ્રાન્સફર બાય નેશનલ ઇલેક્ટ્રોનીક ફન્ડ ટ્રાન્સફર (અનાફર્ટિટી) અને ઇલેક્ટ્રોનીક ફન્ડજ ટ્રાન્સફર (ઇનાફર્ટી)</p> <p><b>કલેક્શન ફેસીલીટીઝ</b></p> <p>25. લોકલ ચેકોનું કલેક્શન</p> <p>26. આઉટ સ્ટેશન ચેકોનું કલેક્શન</p> <p>27. ચેક રીટન - આઉટવર્ક (ચેક ડિપોઝિટ ફોર કલેક્શન)</p> <p>ઉપરનું લીસ્ટ માત્ર એક માર્ગદર્શકતરીકે સંકલિત થયું છે અને તે લીસ્ટ એકજોસ્ટીટ ગણી શકાય નહીં. બેંકો તેમની વિવેકબુદ્ધિ પર, બેઝીક સર્વીસીઝની કૃદેગરીમાં તેઓ યોગ્ય ગણે તેવી વધારાની સેવાઓ સમાવી શકે.</p>	
2	<p>બંડલ પ્રોડક્ટ્સના સ્કોપની બહાર બેઝીક બેંકોંની સર્વીસીઝ આપવી.</p> <p>કેટલીક બેંકો દરેક વ્યક્તિગત પ્રોડક્ટ કે સર્વીસ પર ચાર્જસ ન મૂકે. પ્રોડક્ટ્સ અને સર્વીસીઝ બંડલ થઈને ગ્રાહકનો એક કંપોઝિટ ઓફરીંગ તરીકે આપાય છે. બેંક આ ઓપરેશનોની કિમત નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ કારા રીકવર કરે છે. બેંક બ્રેક-ઇવન લેવલ કસ્ટમર અકાઉન્ટમાં ઊંચા અવરેજ બેલેન્સ કારા મેળવ છે જે તંદુરસ્ત વ્યાજ માર્જન આપે છે અથવા અપૂરતા બેલેન્સ રાખવા પર ચાર્જસ લાદવા કારા. જ્યાંસુધી બેઝીક સર્વીસીઝને લાગે વળગે છે ત્યાં સુધી બેંકોનો ઓઝેક્ટરીંગ એ ખાતરી કરવાનો છે કે વપરાશકારોને વ્યાજબી પ્રાઈસ / ચાર્જસ પર મળે અને આ માટે બેઝીક સર્વીસીઝ બેંડલ પ્રોડક્ટ્સના સ્કોપની બહાર ડિલીવર થાય.</p>	<p>બેંકો વર્કિંગ ગ્રુપની ભલામણો અમલ બેઝીક બેંકોંની સર્વીસીઝ વ્યાજબી પ્રાઈસીઝ / ચાર્જસ પર પ્રાય કરવા કારા કરી શકે અને આ માટે બંડલ પ્રોડક્ટ્સના સ્કોપની બહાર બેઝીક સર્વીસીઝ ડિલીવર કરીને.</p>
3	<p>સર્વીસ ચાર્જસ ફીક્સ અને કમ્પ્યુનીક્ટ કરવામાં વ્યાજબીપણાની ખાતરી માટેના સિધ્યાંતો</p> <p>(અ) વ્યક્તિગતોને બેઝીક સર્વીસીઝ માટે, બેંકો જ્યારે તે જ સર્વીસીઝ નોન-ઇન્નીવીન્યુઅલ્સને આપાય ત્યારે લાગુ પડતા રેટસ કરતા નીચા રેટસ પર ચાર્જસ મૂકશે.</p> <p>(બી) વ્યક્તિગતોની સ્પેશ્યલ કૃદેગરીને આપેલ બેઝીક સર્વીસીઝ માટે (જેવા કે ગ્રામ્ય વિસ્તારોના વ્યક્તિગતો, પેન્શનરો અને સીનીયર સીટીઝન) બેંકો અન્ય</p>	<p>વર્કિંગ ગ્રુપ કારા સમજાવેલ સર્વીસ ચાર્જસ ફીક્સ અને કમ્પ્યુનીક્ટ કરવામાં વ્યાજબીપણાની ખાતરી કરવા માટેના સિધ્યાંતો બેંકો કારા સ્વીકારી કે અનુસરી શકાય.</p>

	<p>વધિતાપોર મૂકત ચાર્જસ જે શરતો પર મૂકે છે તેના કરત વધુ મુકત શરતો પર ચાર્જસ મૂકશે.</p> <p>(સી) વધિતાને આપેલ બેઝીક સર્વીસીઝ માટે, બેંકો જે ચાર્જસ વ્યાપી હોય અને તર્ક સંગત હોય તો જ મૂકશે.</p> <p>(ડી) વધિતાને બેઝીક સર્વીસીઝ માટે, બેંકો સર્વીસ ચાર્જસ એડવલોરમ મૂકશે માત્ર કેપ ન આધીન રહીને કોઈ ઈન્જીમેન્ટલ કોસ્ટનું કવર કરવા માટે.</p> <p>(થી) બેંકો વધિતાગત કસ્ટમમેને અપફન્ટ અનેટાશાલી મેનરમાં બધી બેઝીક સર્વીસીઝને લાગુ પડતા ચાર્જસ પર સંપૂર્ણ માહિતી વધિતાગત ગ્રાહકોને પૂરી પાડશે.</p> <p>(અફ) બેંકો એડવાન્સ માહિતી વધિતાગત કસ્ટમરોને સર્વીસ ચાર્જસમાં દરખાસ્ત મીકેલ ફેરફારો વિશે પૂરી પાડશે.</p> <p>(જી) બેંકો વધિતાને આપેલ સર્વીસીઝ માટે માત્ર એવા ચાર્જસ કલેક્ટ કરશે જે કસ્ટમરોને નોટીફિએટ કરેલ હોય.</p> <p>(અચ) બેંકો યોગ્ય રીતે ગ્રાહકોને અક્ષાઉન્ટ કે ટ્રાન્ઝેક્શનમાંથી સર્વીસ ચાર્જસની રીકવરી વિશે માહિતી આપશે.</p> <p>બેંકો ચૂક્યા વિના ગ્રાહકોને એવા બધા કેસમાં જ્યારે બેંક શરૂ કરેલ ટ્રાન્ઝેક્શન પોતે, જરૂરી મીનીમમ બેલેન્સમાં શર્ટફોલમાં પરીણામે અથવા તે તરફ ઘરી જવાની જરૂરિયતા હોય ત્યારે, ગ્રાહકોને માહિતગાર કરશે.</p>	
4	<p>સર્વીસ ચાર્જસનું ડિસ્કોઝર અને નોટીફિકેશન</p> <p>એ અતિઆવશ્યક છે કે ગ્રાહકોને સર્વીસ ચાર્જસથી માહિતગાર કરાય અને સર્વીસ ચાર્જસમાં ફેરફારોને માત્ર ગ્રાહકોને આગોતરી નોટીસ પાઠવીને જ અમલમમાં મૂકી શકાય. ચાર્જસમાં મૂકેલ ફેરફારો માટે કસ્ટમરોને નોટીસ એટલે દેરેક વધિતાગત ગ્રાહકને નહીં કેમક એ ખર્ચની અને બિનવ્યવહારિક થશે. લર્નિંગ ચુપને લાગે છે કે યોગ્ય ડીસ્કલોઝર માટે, બેંકોગ્રાહકોની નીચેની જરૂરિયાતોને ઓખેતે જરૂરી છે અને એવાં પગલાં લે જેનાથી ખાતરી થાય કે આ જરૂરિયાતો પૂરી થાય છે.</p> <p>(અ) સર્વીસ ચાર્જસનું ડીસ્કલોઝર</p> <ol style="list-style-type: none"> <li>બેંકો સર્વીસ ચાર્જસની એક સમયની પબ્લીસીટી કરવા માટેનો વિકલ્પ વિચારી શકે જીથી બધા ગ્રાહકોને ચાર્જસની ખબર પડે,</li> <li>સંબંધની શરૂઆતમાં સમયે નવા ગ્રાહકોને સર્વીસ ચાર્જસ કમ્યુનીકેટ કરવાની જરૂરિયાત</li> <li>બ્રાંચ પર નોટીસ બોર્ડમાં ચાર્જસ પ્રદર્શિત</li> </ol>	<p>બેંકો એ ખાતરી કરવા પગલાં લઈ શકે કે કસ્ટમરોને અપફન્ટ સર્વીસ ચાર્જસથી માહિતગાર કરાય છે. અને સર્વીસ ચાર્જસમાં ચેંજુસ માત્ર ગ્રાહકોને આગોતરી નોટીસથી જ અમલમાં મૂકાય છે.</p>

	<p>કરવાની અને વર્તમાન પત્રોમાં જહેરાત કરવાની જરૂરિયાત, કસ્ટમર્સ / પબ્લિકને માહિતી ફેલાવવા માટે, વધુમાં, રીજર્વ બેંકની સૂચના પ્રમાણે વેબસાઈટ પર ડિસ્પલે.</p> <p>4. વિવિધ પ્રોફેશનલના ગ્રાહકોને સર્વીસ ચાર્જસ કમ્પુનીકેટ કરવા માટે યોગ્ય મેથડ વાપરવાની જરૂરિયાત</p> <p>(બી) ચાર્જસમાં કરેલ ફેરફારો નોટીફિશિટ કરવા</p> <ol style="list-style-type: none"> <li>1. માત્ર ઓછામાં ઓછા 30 દિવસના સ્ટમરોને આગોતરી નોટીસ ફીકેશન સાથે જ ચાર્જસમાં ચેન્જ કરવાની જરૂરિયાત.</li> <li>2. કસ્ટરને ચેન્જ સ્વીકારવાનો વિકલ્પ આપવાની અને ન સ્વાક્ષરાય તો ઉપરના 30 દિવસમાં કોઈપણ કિમત વિના બેંક સાથેના સંબંધો છોડવા માટેના વિકલ્પ આપવાની જરૂરિયાત.</li> <li>3. બેંકો વર્તમાન પત્રોમાં ફેરફારોની જહેરાત કરવાનો વિકલ્પ વિચારી શકે.</li> <li>4. ગ્રાહકને મોકલેલ કોઈપણ કમ્પુનીકેશનમાં ફેરફારોને લાગતી માહિતી સમાવવાની જરૂરિયાત.</li> <li>5. નોટીસ બોર્ડમાં કે વેબસાઈટ પર પછીના 30 દિવસમાં કરેલ ફેરફારો પ્રદર્શિત કરવાની જરૂરિયાત.</li> </ol>	
5	<p>અન્ય ભલામણો</p> <ol style="list-style-type: none"> <li>1. સર્વીસ ચાર્જસ વિશેના ગ્રીવન્ઝીઝના રીડ્રેસલમાં ખામીએ.</li> <li>2. નાણાકીય શિક્ષણ</li> </ol> <p>બેંકમાં વીલંબીત કોરસપોન્ડન્સના પ્રોસેસ સહિત ખામીપુકત અસંતોષનું નિરાકરણ હુમેશા બેંકીંગ ઓમબડઝમેન / રીજર્વ બેંક સુધી જતી ફરિયાદો તરફ દોરી જાય છે. બેંકને તેથી રોબર્ટ ગ્રીવન્ઝ રીડ્રેસલ સ્ટ્રક્ચર અને પ્રોસેસીઝની જરૂર છે, એ ખાતરી કરવા કે તેમની બધી ગ્રાહક ફરિયાદોનું તત્કાલ ઈન-હાઉસ નિરાકરણ થાય છે.</p> <p>2. નાણાકીય શિક્ષણ</p> <p>વર્કીંગ ગ્રૂપ ભલામણ કરે છે કે બેંક પ્રોડક્ટ્સ પર કુલ-કલેજડ માહિતી અને તેમની ઇમલીકેશન્સ (સૂચનાઓ) કસ્ટમરોને જરી કરાય જશી ગ્રાહકો માહેઠગાર જજ્મેન્ટ તેમની પ્રોડક્ટની ચોઈસ પર કરી શકે.</p>	<p>અસંતોષના રીડ્રેસલ અને ફાયનાન્સીયલ શિક્ષણ કોલમ 2 માં આપેલ, ને લગતી વર્કીંગ ગ્રૂપની ભલામણો બેંકો દ્વારા અમલી થઈ શકે.</p>